



# जैन धर्म प्रकाशः

JAINA DHARMA PRAKASH.

युवती २ रु. अपाइ युदि १५ संसात १८४१ अंक ५ सो.

इंद्रवल्ला.

जिनेद्र पूजा गुह पर्युपास्तः  
मत्वानु कंपा शृण पात्र दानं  
गुणानुरागः श्रुति गग गम्य  
सुजन्म वृक्षम्य फलान्य पूनि ॥?॥

प्रभाष इति.

श्री वैन वर्म प्रसारक सभा.

लखनऊ.

— छट्टूल्ला —

आमदावादमां.

युवती २ रु. अपाइ अन्न र. डे. ए. एनियर ना ब्रिग्यां  
संप्रबोधताव गंगाचन्द्र जाली प्रभिद इष्ट.

गुण वर्ष २ अंक २१ २० अप्रैल १८४१ रुप्त.

## વિજાની.

સર્વ જુરા આહકોએ આ યોગાતીપાતા સરદય મૂલ્ય તરફ વિચાર ન કરતાં તેથું સારી રીતે ખડુ માન સાચવી લાંચયું. બીજાંદું આસાતાન કરવી નહીં કારણું કે રાનાની આસાતાન કરવાથી અરૂપાનમણું પ્રાપ્ત થાયશે અર્થાતું રાનાનરણી કરે બંધાપછે. આ વાક્યને લક્ષમાં રાખીને યોગાતીયું વાંચીને રખાયું ન મૂકતાં યોગ્ય સ્થાનકે મૃડી વિવય સાચવું જેથી કરેલો પ્રયાસ સાફળ થાય.

— ઝડપ ઝડપ —

## અનુક્રમણિકા.

વિવય.

૧ જગતકર્તા ખંડન,	...	...	...	...
૨ વૈરાગ્યરસ,	...	...	...	...
૩ ધર્મદાટા,	...	...	...	...
૪ સમકિત (આરામનંદની કથા)	...	...	...	...
૫ સત્ત્વ (અજા પુત્ર ચરિત્ર.)	...	...	...	...

— ઝડપ ઝડપ —

## લવાજમની પહોંચ.

૧-૩ શા ગઢુલ નેમલા.	૧-૩ શા હરીયંદ જગત્યવન.
૧-૩ શા ઇપચેદ મલ્લકચેદ.	૧-૦ શા ડાલા ક્રીણા.
૧-૩ ભેતા લખુ કાળીદાસ.	૧-૩ ભેતા કલ્યાણશુદ્ધ મુશ્ય.
૧-૩ ભેતા યુદ્ધાયંદ જીવા.	૧-૦ શા અનેર બાધચેદ.
૧-૩ શા દીપચેદ ખીમા.	૧-૩ શા વીરચેદ જીવા.
૧-૦ પારેણ ખીમા ક્રોર.	૧-૩ શા મગન શાનચેદ.
૧-૩ શા ડેવણ ખીમચેદ.	૧-૩ દેશી સુંત્રા નીણા.
૧-૩ શા રોપચેદ રતનચેદ.	૧-૩ શા નેહાભાઈ તલકશી.

# શ્રી જૈન ધર્મ પ્રકાશ.

## JAINA DHARMA PRAKASH.

દેવદૂ.

ગાયત્રીસાહી વિજાય, પાણી પુણી વિજાય;  
દેવ ધરે ઉત્તીર્ણાયા, પ્રગટ્યું જૈનપ્રકાશ.

પુસ્તક રૂપ. રૂપ. ૧૮૦૭ અધ્યાત્મ શુદ્ધિ ૧૫. સંપલ ૧૫૪૨. અંક ૫ મો.

### જગતકરી સ્વંદન.

લખિતાત છુદુ.

મેગલનિદ્ધાન સમાન વાણી જાળ્યો અરિંદતની,  
તે પામિને ચુણવેન કર્યો તથ જલ કુર્યેની;  
મિથ્યાતના ઘનમોર વાદા રહાં અંધર છાયાને,  
કર્તી જગતકા કોણું પુષ્પજન દેખાયો સુવિચારિને. ૧  
ધૌધ્રી કહે આ જગત સધારું ક્ષણિક લંગુર જાળ્યીય,  
નૈયાયિકોના મત થકી ઈશ્વર રચ્યું પીઠાનિય—  
મીમાંસકો નારિતા થયા ઈશ્વરપાણું ઉથાપિને,  
કર્તી જગતકા કોણું પુષ્પજન દેખાયો સુવિચારિને. ૨  
કેદી કહે આ જગત સધારું રજે અહા મીતથી,  
તો પુછ્યે હમ તેણે અહા અન્યા કોણું રીતથી;  
વેદાંતિ તો લાંટિ વાણી વાગમાં રચા લાપયાને,  
કર્તી જગતકા કોણું પુષ્પજન દેખાયો સુવિચારિને. ૩  
માયા કહે નેતૃ જગતની રચનાર છે આહિ થકી,  
૪ જોક નૈયાયિક ગોગાંચાક નિંબા દન્ધાંશાની મળ વાણી.

६६

## શ્રીજાનાથમં પ્રકાશ.

તો માયાના રચનારની ચિંતા થણે પહેલાં થકી;  
વેશપિકા જડૃપ માને મુક્તિમાં નિર્ધારિને;  
કર્ત્તા જગતકા કોણું ખુદ્ધન વેખનો સુવિચારિને. ४  
ઇથ્રર રોજ ઇથ્રર રોજ ઇથ્રર રોજ આ જગતને,  
ઓમ નોરથી ઘનમોર કરિને બ્યાલણો ખડુ જો તમે;  
તો આપણો દુષ્પાણ તળ્ણુ ધણી રેલ ગાડી ભરાઈને,  
કર્ત્તા જગતકા કોણું ખુદ્ધન વેખનો સુવિચારિને. ५  
લાલા કરી આ જગત અધિકું રોજ ઇથ્રર મેમથી,  
તો રાગી દેવી જાણુવામાં રતોક પણ શંકા નથી;  
મચ્છાનત વિન પ્રવર્તિ પણ જાચિત છે નહી મંદને,  
કર્ત્તા જગતકા કોણું ખુદ્ધન વેખનો સુવિચારિને. ६  
દ્વાર્ગુતાથી ઇથરે જો જગત સરળું માનીયે,  
તો સકળ જંતુ એક સરખા સુખી કરું ન પિછાનીયે;  
તે માટે ઇથ્રર જગતના રચનાર નહિ નિર્ધારિને,  
કર્ત્તા જગતકા કોણું ખુદ્ધન વેખનો સુવિચારિને. ७  
સહુ પક્ષપાત તથ તમે જો જૈન તત્ત્વ વિચારણા,  
તો સર્વ શંકા દૂર થાણો પરમ પદવી પામણો;  
શુદ્ધ રાંત રસમાં લીન થાવા જુઓ નેત્ર ઉધારિને,  
કર્ત્તા જગતકા કોણું ખુદ્ધન વેખનો સુવિચારિને. ८

—**હૃદ્દંહૃદ્દ**—

## વૈરાગ્ય રસ.

(અનુષ્ઠ્રૂપ વાત.)

અસ્યા હુંડાંકસપિણ્યાં, દુર્ધરેંચમારકે ।

મનુપ્યત્વંતુજીવાનાં, દુહુંમતિદુહુંમં ॥૯॥

૧. આગગાડી.

૨. અરાંસ્યાત જીતાંણાણી અતસપિણ્યી વ્યતીત ધંધો પછી ઝાયછે

वैश्यसभा



तत्रापिसर्वसौख्यानां, भाजनमिवभाजन ।

वैराग्यरसस्वादा ५५ स्वादनंदुर्लम्बन्तुघैः ॥२॥

हे भव्य श्रवो ! आ संसारमां मनुष्यपाणुं प्राप्त थाँ अति हु  
क्षिप्त हो कारण के पूर्णे पुन्यनी सामग्री शिवाय ते प्राप्त थाँ नथी.  
ज्ञानो के देव हेषेद्र पण चाते पामेली रिहिने ताण समान गणी  
मनुष्यपाणानी धृष्टा धरावेहे. ते मनुष्यपाणुं, आर्य देश, उत्तमज्ञाति,  
अंष्टु कुण प्रमुख प्राप्त थाँ छतां प्रभाद कृतो ए चाक्षात्किळानी भृ  
णीने लायक नथी, केम्के जे माणी प्रभाद करी धर्म कार्यमां अनुष्ठ  
भी रहेहे अने वैराग्यरसने ध्येयदृप करी ध्यानता नथी तेजाने अंते  
पश्चाताप थवामां कांचिद्दक जाणुवो नहा.

जे माणी आ संसारमां अभुव्य मनुष्य जन्म संपादन करी  
परछनना थात कृता प्रवर्तेहे ते चातेज दुष्टायहे, जे असत्य त-  
चन योदेहे ते चातेज ज्ञानो पडेहे, जे असत्य वस्तु शहण कहेहे  
ते चातेज कर्मदृप शत्रुथी शहण थायहे. जे प्रदारा गमन कहेहे  
तेन चातेज नर्कमां गमन करुं पडेहे, जे परिशहनी अति ला-  
लसा कहेहे ते चातेज कर्म कादवथी लपटाय हे. अने जे दोषदृप  
अजिनो रपर्श कहेहे ते चातेज हुःभृप 'आ तापना' पामेहे. वजी  
अहिंसा एज प्राणीभावनुं हित कृतानी हे, सत्य एज कहेहे.  
एनो कोरा हे, अस्तेपता एज अल्पुद्धनी आपनारी हे, अद्वय  
एज भुजा दोकाने वरवा योग्य हे. अने अपतिश्छु एज चाक्षरूप  
लक्ष्मीनुं गृहेहे एवं ज्ञानी, महाराजाए आगमनी अंदर वारपार  
कहेहे हे; माटे हे भव्य माणी ! भाङ्कर्मनी जगमां न इसातां अ-  
हिंसा, सत्य, अरतेप, अद्वयप अने अपार्श्चहमां अद्वाकाण रहाग-  
ही रहेहे; स्वप्रमां पण परस्ती, परदोष के प्रदृष्ट्यमां परायण न

१. पर्की.

૬૮

શ્રીનાનગવિદે પ્રધાણ.

રહે અને નિરંતર પોતાના માણામ સરલ રાણો, જેથી શીવચુદ્ધ  
અહૃપકાળમાં માસ થાય.

વિચારો કે આ લ્યે ગર્ભિવાસમાં કેટલું હૃદાય સહિત કર્યે  
અને ત્યાં જીવ કેવી સ્થિતિમાં રહ્યો હતો. વળી મળસુન્ન રહેઠમાં  
વચ્ચી કેવી દુર્ગધ સહિત કરી તે સર્વ હૃદયનું વાર્ણુન કરવાને મૌખિકાની  
પણ અશક્ય છે. જેમ કોઈ મનુષ્યના શરીરમાં સાડીવાગુ હોએ  
શાય ઉની કરી ચાંપીએ અને તથી તેને કેટલું હૃદાય ઉત્પન્ન થાય  
તથી પણ ‘આ ડગાણુ’ વેહના ગર્ભિવાસમાં થાય. કહુંછે કે—

કોઈ ચાંપે ઉની કરી, કોડ સાડીવાગુ શાય;

તેહથી આડ ગાણી વ્યથા, ગર્ભિવાસમાં હોય.

આ પ્રમાણે ગર્ભિવાસમાં સહિત કરેલાં હૃદાયને ભુલી જઈ માણા  
અતિ આંદ્રતિપણું ધારણ કરેછે તે આંદ્રતિપણું કઇ ગતિને માસ  
કરાવશે તેનો ખીલકુલ વિચાર ન કરતાં તેનો નિશ્ચય કરવાને વાસ્તે  
તે જીવનેજ મુખત્યારીપણું શાંપીએ જીવો.

હું સંઘળી પાતાનો વિચાર કરતાં માલમ પડેછે કે આ ભર્યા  
કર સંસારમાં પરગોપકારી શ્રીમહ્ અરિહંતના ચરાણુકમળની છાયા  
રિવાય ખીજ્ઞ કોષ્પિણ નિર્લેયસ્થાન નથી, માટે શ્રી જીનેદ્ર દૈવતી  
વાણીરૂપ પુષ્કરતર્ત્વ જોગની વૃદ્ધિએ કરી પોતાની હૃદયરૂપી ભૂમિમાં  
ધર્મરૂપ કલ્પયુક્તનો અંદુર રથાપન કરવો જોઈએ; અને ક્ષમારૂપ ચં  
દનતી પાડ કરી છલ્લોક પરકોકમાં હતમ ઇની આપનારી ધર્મરૂપી  
કલ્પલતા મફુલિતા કરતામાં નિરંતર ઉદ્ઘમંત થયું જોઈએ. વળી તી  
ર્થયાત્રાદિ કાર્યમાં પણ સદા ભ્રયલનનાન થતું જોઈએ, કારણુ કે તી  
ર્થની પાંથરકે કરી આ લ્યે કર્મરૂપ રજથી રહીત થાયછે, અને  
તીર્થલૂભિમાં વારંવાર આટાન કરતાં ભવ ભમણથી વિમુક્ત થાયછે;  
સોમજ તીર્થસ્થળે ગમન કરી ધ્યાન કરતાં પોતે ધ્યયરૂપ થાયછે; વળી  
અતોદ્ર ભગવંતનું પૂજન કરતાથી માણી પોતેજ પૂજયનીક થાયછે,

### धर्मदृढ़ता.

६७

अने के माणी तत्रथ श्रीमह अरिहंतदेवनी सतपता कुछ ते गो-  
तेज सतपनीक थायछे. आठे आ ममाणु भडान् लाल आणी पोतानुं  
भन भेडु कर्मनी वासनाथी घेची लाईने पैराग्यरसे करीसिंचन करौ!  
तेमज फुर्गतिमां जपाने तैयार थेला भनुष्याने लाई सुगतिमां धा-  
राणु करे अवो ने वीतराग भणित धर्म तेनी उपर निरंतर द्रष्टा-  
राणो जेथी भेक्षण्यं लक्ष्मी संपादन थाय. तथारतु.

### धर्मदृढ़ता.

(नाराय छं.)

‘गगर्व्यै पृक्षने’ भद्रा विशाळ काम कुण के,  
न आपवा समर्थ ते कृष्णि भेक्ष धामने;  
विचारिने विमासीने विद्याकुचे छिचे यदा,  
ददा रादानि धर्म धर्म धर्म दृष्टिगत गुदा. १

आ वरापांडमां वसंतापुर नगरनी समीये भनोहर सहकार,  
नारंग, जंगलप्रसुण पूर्णोथी रसाळ एक वन हुतु. ते वनमां एक  
जमदग्नि नामा तापस तप करतो हुतो, अने तेनी भसिष्ठता सर्वेस्थ  
के व्यास थेली हुती. ए समय देवदेवा के भवय ऐ देवता परम्पर  
६६ भिन्नाई धरावता यका वसता हुता. तेओमां एक देवनुं नाम  
विश्वानर हुतुं अने ते परम श्रावक तथा दृढ़ धर्मी हुतो अने धनो  
धनवंती नामा शीवधर्मी अने तापसना परमाकृत हुतो. ते खने  
देवता एकदा पोत पोताना धर्मनी भर्तीसा करता हुता, तेमां एक  
कुंचु के श्री जैनधर्म समान्. खीजे कोइपणु धर्म नथी. खीजे  
कुंचु के शीव धर्म समान खीजे कोइ पणु धर्म नथी. आ म-  
भाणु ते खने देवता अन्याअन्य वाइ विवाद करता पोताना धर्मनी  
परीक्षा करवा आ भनुष्यदेवाकमां आव्या. तेव्वधूते धर्म विश्वानके

२० कृष्णनृक्ष.

કહું કે જૈતર્ધમે મધ્ય જગત્યથી નવાચિત સાધુની પરીક્ષા કરવી અને તારા શીખ ધર્મમાં ને માચીન અને દૃઢ ધર્મી તાપસ હોય તેની પરીક્ષા કરવી.

એ અવસરે મિથિલા નગરીના રાજ પત્રરાયે હોતાની રાજ્યથી ત્યાગીને શ્રી વાસુદુર્ય તીર્થકરની પાણ દિક્ષા લીધી હતી તેની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યો અને મનુષ્ય વેશ ધારાંણ કરી મિથ્ય લોજન તથા અનેક મફારના સુગંધી જળ લઈને તે મુનિ પાણ ગયા અને કહેવા લાગ્યા કે હે મુનિ! આ રસવતી નિક્ષા અને શીતળ પાણી વિગેરે આપ ગૃહણ કરો. તે વખતે મુનિ સુધ્ય તથા તૃપ્તાથી અત્યં પ્રાઇત છતાં તે 'અને પણીય' લોજન અને જળાદિ ગૃહણ કરતાન હિંદુ ઘરી પ્રથમ પરીક્ષા.

પશ્ચાત્ જ્યારે મુનિ તે નગરથી પીછે રથને જવા લાગ્યા ત્યારે તે ખંડે દેવતાઓએ આગળ જઈ એ મફારના રસતા ઘનાયા. એક રસતે કાંદા અને કાંકરા વિકુર્યા અને પીછે રસતે પાણી, વનરપતિ તથા દેડકા મનુષ છુષ વિકુર્યા. તે બેદ મહા દ્યાળું અને અપ જાંતિએ કરી 'પરિક્લે શિત', નંતુઓના વિશ્રામને અંથે વૃક્ષ તુલ્ય, અને આપત્તિરૂપ મહા નદીના પાર ઉત્તારવાને જેમળી દૂધી નોકારૂપ છે એવા તે મુનિ, સર્વ માણીમાનને વિષે જે દ્યા છે તે ધર્મના તિલક સરખી લૂધાળૂરૂપ છે, અને તે સર્વ શાગનો અને સર્વ અનર્થનો નાશ કરતાર છે, અને દ્યા એજ સંપત્તિ અને કલ્યાણનું કારણ છે, એમ વિચારીને છુષહિંસાના લયથી દેડકા મનુષ છુષેઅ સંયુક્ત માર્ગ ત્યાગીને કાંકરા કાંદા અને ટીંખા ટેકરાવાળા માર્ગ ગમન કરવા લાગ્યા. રસતે ચાલતાં તે સાધુના પગમાંથી દૃધિરની ધારાઓ વહેવા લાગી તો પણ તે મુનિનું મન જેમ કલ્યાંતકાળના પવનથી મેરુ પર્વત ચલિત થતો નથી તેમ નિશ્ચળ રહેતું હતું. આ પ્રમાણે તે દ્વાતારો સાધુશુના મન પરિણામ આગળ હેળાને જાનદાર્ય પાર્ય પાર્યા.

धर्मदला

७१

## धर्ति द्वितीय परीक्षा.

હેતે તે સાથુની સમીપે અનેક પ્રકારના ગીતગાન, રંગરાગ વિ-  
ગેરે માયા વિકૃતી અને દેવાંગનાનું સ્વરૂપ ધારણા રી તે દેવતા  
ઓએ હાવબાળ સંયુક્ત નાંક પ્રારંભિત. તેમ છતાં પણુંસંયમને નિયે  
જેણું ચિત્ત અત્યંતોત્સુક છે ઓના તે મુનિનું મન કુરિયુંમાત્ર પણ  
ચલાયમાન થયું નહીં અને પોતાના અંતર્ગમાં અનિય ભાવના  
ભાવતા થકા મનવચન કાયાના ત્રિકરણ ધાગથી અડોસ હા.

## धર्ति તૃતીય પરીક્ષા.

છેષટ તે ખને દેવતાઓ નિમિત્તિયાનું સ્વરૂપ ધાર્યા કરી મુ-  
નિની સનુષ પગટ થઈ કહેવા લાગ્યા કે લો મુને ! આં નિમિત્તિ-  
યા છીએ અને અમારા નિમિત્તના મનાનથી જાગ્યુંએ છે કે તેમ  
દીર્ઘયુષી છે. માટે અમારું વચન અંગીકાર કરીને આ ચાન્તાવરસ્યા-  
માં તપદ્યા કરવી છેઠી દઈ નાના પ્રકારના મનુષ્યનોગદ્દા અને  
કંચન સમાન નાયા નિરર્થેક ન ગુમાવો. ચારિત્ર તો પૂર્વસ્થામાં  
પણ અંગીકાર કરી રામય છે માટે અમારું કહેંનું માન્ય કરે સંસાર  
સંસંધી સુણાયો પરાદ્યસુણા ન થાયો. નિમિત્તિયાના આપ વચન  
અવાગું કરી તે મુનિ મહારાજ કહેવા લાગ્યા “હે ‘ભદ્ર મુપ’ ! આ  
અમાર સંસારમાં ધર્મ એવું સારભૂત છે અને તે મનુષ્યપાણું માગ કરી  
દીર્ઘયુષ્ય વિના સાધવો દુર્લભ છે અને ગતાયુષ્ય પુનઃ પ્રાપ થતું  
નથી. કર્યુંછે કે—

**अनर्धाण्यपिरलाने लभ्यंतेविभवैःसुख्म् ।**

**दुर्लभो रबकोश्यापि क्षणोपिमनुज्ञायुषः ॥२॥**

માટે ને ધર્મ સાધન કર્યું તેજ આપાણું છે અને જરાવરસ્યા  
પ્રાપ થયે શરીર લાર્યા થઈ જવાથી તપદ્યાહિ કુયા થઈ શકતી ન-  
થી. એ તમારા કહેવા સુજર્ય મારું આયુષ્ય લાંબું છે તો મારાથી

૭૨.

## શ્રીજીનામં પ્રકાશ.

ધાર્યા કાળ સુરી ચારિન પળાણે. આની રીતના તે મુનિના મમતા રહીત વચ્ચેનોસાંભળી ખચે દેવતા અત્યંત મનોદિત થયા અને નિષ્ઠય કર્યો કેબા જાણું સંદેશ ધર્મ દદતા ક્રીએ વિરલા પુરુષમાંન હુશે. ધન્ય છે જૈદ્યમેને! કે જે માસ થયાથી માણીને આની રીતની ધર્મને વિપે દૃતા સંપાદન થાયછે.

## ધર્તિ ચતુર્થ ગજિશા.

આ જે અત્યંત મધ્યંસા કરી શીએ વર્ગના વૃદ્ધ તાપસની પરીક્ષા કરવા માટ્ટો ગાંચે દેવતા જાણ્યા અને પૂર્ણાંકા જે જમદાંનિ નાંગે તાપસ ઘણે માચ્યીન, જટાધારી અને દૃઢ ધર્મની કહેવાતો હતો તેની પાસે આંદો.

આ જમદાંનિ તાપસ ધાર્યા લાંબા વખતથી ક્ષયાનારૂપ થઈ ધ્યાન કરતો હતો તેથી તેની જટા વિગેકે સ્થાનોમાં પક્ષીઓ નિવાસ કરી રહ્યાંહતાં. આની સ્થીરિ દેખી તે ખચે દેવતાઓએ પાગુ જોતાનું ઇપુરુષદ્વારાને ચકલા ચકલીનું ઇપ ધારણું કર્યું અને તે વ્રદ્ધીની પગલિમાં એક માણો જીનાની તેની અંદર રહેવા લાગ્યા.

અયદી ચકલો મનુષ્ય લાધાએ કરી ચકલીમત્યે કહેવા લાગ્યો “હે ડાંતે! હું આજનોને દિગાંત પાંત ડાર જાણાની રહાયા રોખુંછું.” આ વચ્ચેન સાંભળી તેણુંઓ કહું કે ત્યાં જઈ તું ખીલ ચકલીની સાથે ગૃહ્યવાસ કરી તેજ રથણે રહે તો હું ચું કર્દે? તે કારણું માટે તારે હિમાંત પર્વત ઉપર જવાનું ખંધ રાખતું. તે સાંભળી ચકલાઓ કહું કે જે હું ત્યાં જઈ પાછો ન આવું તો મને સ્ત્રીહત્યા દૂર્થી ગોહૃત્યા કર્યા જેટલું પાપ થાઓ! આની રીતે કહ્યાં છતાં પણ ચકલીઓ તેનું વચ્ચેન માન્ય કર્યું નહીં, પરંતુ કહેવા લાગી કે તે ખાંડી મતિજ્ઞા આસરય છે, હું તેમાંથી એક પાગુ મતિજ્ઞા સત્ય માનતી નથી, કિંતુ આ જમદાંનિ તાપસો જોતાની આપ્યી ઉમરમાં જેટલા

धर्मदृष्टा.

७३

पापनो संशय कर्याछ ते जे तुं पोताने माये द्विवारुः” अंगीकार कहे तो जवानी आज्ञा आएँ।

आ पात सांलभी केनी कांति कोषे करीने तान्धवर्ण शृङ्खले अने जेना नेत्रो जपे करी निमेष रहीत हो अदो ते त्रैषि तेनी उपर अत्यंत हापायमान थहने ते अन्ने पक्षीओने माणा सहीत जेची पोताना हाथमां लट्ठ कहेवा लाग्या “हे रही ! मैं अबुं शुं पाप कुरुछे ते तुं सत्पर जाल, नहीं तो आ पध्यते ताहे भाएँ अने शरीर जूदां थामां कांधपिण्य संराय न धरीशी।”

तेना आपा कोधयुक्त पचन सांलभी तेणीचे कहुं “हे त्रैषि ! तुं पोताना शास्त्रमां शुं कहुं हो तेना विचार करी पछी कोध कर, यदुकर्ते—

**अगुत्रस्यगतिर्नास्ति स्वर्गनैवचनैवच ।**

तस्मान् गुत्रमुखं हृष्टा पश्चादुर्मसमाचरेत् ॥२॥

अगुत्रस्यगृहं शुन्यं दिशिशुन्याभवाधर्वाः।

मूर्खस्यहृदयं शुन्यं सर्वशुन्यं दरिद्रता ॥२॥

माटे हे त्रैषि ! कोधन्ना त्याग करा संपूर्णा अदिवमां प्रवेश कर.” यक्कीना आपां पचन श्रवणे करी त्रैषि भनमां चिंतपवा लाग्या के अः पक्षीतुं कहेवुं शीक्षे भाटे भारे हवे विवाह करवेउचितहो-

अ रोते निश्चय करी त्रैषीधर तो ध्यान तप जपादि छोडी द्वाष्टिक नगरना राजा लुतश्चने त्यां खडु शुन्नीओ छे अम सांलभी त्यां गया. (जुओ कर्मनी विचित्रता अने शीष धर्मनी दृष्टा शुरुते तेमां शुं आश्र्वय हो, कहेवत हो के जेना शुद्ध आंधना तेना श्वला भीत.) आ भभागे ते त्रैषिनी धर्म दृष्टा देखीने अन्ने दृष्टाक्षा

१ जुओ त्रैषिना धर्म दृष्टा !!!

૭૪

## ઓર્નાર્થમં પ્રકાશ.

નિજ રવદ્વય ધારાણુ કરી આપક ધર્મને વિષે સંપૂર્ણ દૃઢ અછતો રવ-  
રખાનકે ગમન કરતા હુલા.

અહે ! શ્રી જૈનધર્મ સમાન એ અલાંડ ભાંડાદરમાં એવિને કોઈ  
ધારુ ધર્મ નથી માટે તે અંગારા કરી તેને વિષે સંપૂર્ણ દૃઢતા ધા-  
રાણુ કરવી જેથી અગાર્ધ પુન્ય સંપાદન કરાય.

## સમકિત.

(આરામનંદાની કથા.)

સાંધાળુ પાને ૬૦ થી.

આ પ્રમાણે તે સીની પાછળા કુલા કેટલાંએક વણત ચુદ્ધી  
આદ્યો. ચાલતાં ચાલતાં એક કાલિકા દેવીનું મંદિર આંદું, પેલી  
સ્ત્રી તે મંદિરમાં ભવેશ કરીને દેવીની પતિમાને નમસ્કાર કર્યો.  
પછી તેનું અથાવિધિ સૂજન કરી પોતાના મસ્તક ઉપર જે ધૂળ કુ-  
શુક હતો તે દેવીના ગળામાં આદેશપણુ કર્યો. તરતજ મંદિરની પણ-  
હાર નીકળી અદૃશ્ય થઈ ગઈ.

આ પ્રકાર જોઇને જેને અત્યંત જાનનદાશર્ય માસ થદો છે એનું  
વો કુલર લાળુ દ્રાઈ દેવીભક્ત તેનું નિર્માલ્ય ગૂડાણુ કરતો હોય તેમ  
તે કેંચુક દેવીના શરીર ઉપરથી ઉતારી જોતે ગૂડાણુ કરી નહી તરફ  
ગમન કરતો હુલો. જ્યારે તે નહીના કીનારા ઉપર આદ્યો ત્યારે  
ત્યાં નોકા અથવા નોડાધિપતિ એં એમાંથી કેંઠ તેની દ્વારા પડ્યું  
નહીં. તેથી તેણુ કેટલાંએક વણત ચુદ્ધી શોધ કરી પણ તેની કંઈ  
પણ શોધ ન મળવાથી તેમજ રાત્રીને ઘણ્ણુ કાળ વ્યતીત થવાથી  
જ્યાં મુસાફરીની તૃપ્તા શાંત કરવામાં આવેછે જોતા એક પરણને  
વિષે જર્દ સૂતો. કલું છે—

અતિમુક્તતાંપુંસા ચિતારહિતાંચેતસા ।

समक्षित.

५७

## अतिप्रयासश्रांतानां निद्राहिमुलभास्ता ॥१॥

ते भमाणे ते तरत निद्रा वश थया. तेवामां दैवद्योगे कुटलां  
ओं आदा व्यभाग् करता करता ते रथले आरी पहेंचया. तेओंचे  
रां आरामनंदननं निद्रावश थयेवा बोया. तेती पासे आ वणते  
भुंगधमय झुप्पे कंचुक शिवाय खीन्हुं कांधपाग् हुनुं नहा ते पाग्  
ते कंचुक दृष्टीने बोडेतुं भन लखयायुं. केज्जाने आ हृष्टुंत्य कृ-  
पांचे रज्जिनि सदायभूत हुती आवा ते बोडे आरामनंदनं अति कुप्ते  
उरी भास केवो आवो ते कंचुक गृहाणु कशीने त्यांथी चालता थया.  
भातःकाजे ज्यारे चाक्ताकु पक्षीना हंदूने हृष्प पमाइतार, कमाना  
वनने भड्डलीत करतार, तरकर, वृवड, अने अविसारिकाओंनो  
शब्द दीनकर उद्याचल पैरेत उपर भगव थया त्यारे कुवर निंद्रा  
रहीत थया. जगृत अपरथा भास थया पांडी ज्यारे तेते योतानी  
पासे कंचुक चालम न पड्या त्यारे से अत्यंत निराम नारीने हा-  
हाकार करता लाग्या. अत्यंत आकुण व्याकुण थवाथी इद्य तो  
आणे शाढी जर्हुं देव नहा तेम थवा लाग्युं औ भमाणे शोके कशीने  
जेतुं इद्य घरार्ह गंधुक्षे आवो कुवर भुर्छामत्ये पाघ्या. केद्यलीओंक  
वारे वनना मेंद मेंद पवननी देहाथी ते सवेत थया. पाणी गांद  
केद्यास्वरे दृढ़न करता लाग्या “हा मति जट! मैं कौनी भुर्छाए  
उरी के के कंचुकने गाए भारी भाग्यमियाना आवाथी नर्मदा न-  
दीना अगावे ज्यामां पाग् ओंक नाली नौकामां ओभी भुसाइरी उरी,  
दृष्टीनी पाणु अपज्ञा करी अने वनमां कष्ट सहृन कुर्हु ते कंचुक आवे  
अज्ञाष्ये हेमाणे सावध न रहेतां भमादमां रहेताथी गुभाव्ये, ओं  
पवमां भारी सं॒ आशा निष्ठाग थारि पुनः ते भास कुर्ही शिवाय  
भारी मिया पवावता गारे केम वर्डी. मत्यादि गांव रवृङ् इद्यना  
अमने छेदी नांण आवा श्वरावडे आहोंश दृ. गाव्या. तेने के-

ઇને પનના વૃદ્ધો પણ કરુણાને પણ થઈ જાગે રૂદ્ધ કરતાં હેઠળની અંબું નાસવા લાગ્યું. એ મમાળું અનેક તરેહના સકૃદય લિકલ્પે કુંશને જેને અત્યંત દીલગીરી માસ થઈ છે એવો આરામનંદન કરતો કરતો એક વિરાળ શહેર પાસે આવી પહોંચ્યો. જેની ગોતરણ નાના પદ્ધતિ વૃદ્ધોની ઘનઘટા શોળી રહીછે, જેના પૂર્વ દરવાજી નજીક એક સુગંધમય અને શીતળાનળે કરીને ચુક્તા એંબું સર્જાવર શોળી રહ્યુંછે, જ્યાં શીમણોની લખ્ય હવેલીચા આકાશ સાથે વાત કરતી હોય એમ હેખાયછે, જેને વિષે અનેક શિખરખલ અને ચુનાર્ણિમય છન્નમાર્ગાં શોભી રદ્ધા છે એંબું આ પાઠણુપુર નગર છે એમ કેદલાએક પુરવાનીઓને પૂછતાં કુવરને માલમ પડ્યું. ૨૨તે આલતાં નગરીની અનુપમ રચના જોઈને મહાયુહ્મિમાન એવો તે કુંઠ અલકાપુરીને પણ ટૂણું તુલ્ય મ નવા લાગ્યો. તે નગરને વિષે નમરકાર કરતારા મંડળીક રાજાઓના ભરતકની માળાના પરિમળે કરી જેના ચરણાભાળ સુગંધયુક્ત છે, વારાંગનાના હસ્તકમણે રહેલા ચામરે કરી જેને પાણું ઢોળાયછે એવો અને માગીમય સિહાસન ઉપર યેમનારો જાગે ધીને છંદ હેઠળની એવો લક્ષ્મીધર રાજ તે નગરીને વિષે રાજ્ય કરતો હતો. ત્યાં ચૌથાને વિષે કરતાં કરતાં શિખરકણશદ્વલએ કરી સુશોભીત છંદભૂપન સદ્ધ છન્નમંદિર જોઈને જેમ ચંદોદયથી ચકોર મફુલીત થાયછે તથા જેમ ધ્યાય મેધની ધર્યા જોઈને મય્યાં આનંદયુક્ત નૃત્ય કરેછે તેમ આ ચુંદ સમ્યકતાધારી દ્વારા ધર્મવૈત અને છનાજ્ઞા પાળક એવો આરામનંદન જાળે પોતાને આકર્માતું નોંધો લાલ માસ થયો હોય તેમ પરમેલ્લાસ પામીને તે છન્નમંદિરને વિષે પ્રવેશ કરતો હવો.

ત્યાં ઉત્તમજ્ઞતિનાં રત્નબહીત મુકૂર મંડનથી જેમનું મરતક શોભી રહ્યું છે અને જે શાંતમુદ્રાએ કરીને ચુક્તા છે એવા છન્નેખર અગવંતાની વિવિધ છંદ રગનાથી રતુલિ કરતા અને હર્ષાલાસથી

## समक्षित.

५७

नृत्य करता धारणा अहावंत लक्तन्तोने तेजु नेया. हुँवर पाणि अंजलीभूक् प्रणाम करी तथा अक्षितपूर्वक छनेखर लगवंतनी स्तपना करी चितना उल्लासपूर्वक चैत्यवंदना करवा मनुनी सन्मुख नेहो. छनालयमांथी घरहार नीकाला पढ़ी जेनां ३५, शालाग्य तथा वाकुचातुर्यथी अत्यंत मोह मास पद्मो छे क्लेने एवा धनदस्म सागर श्रेष्ठिये तेन वेशाथी परदेशी ज्ञानीने पोताने धरे पद्मारतानी मार्यना करी. उचित समयने ज्ञानीनारा हुँवरे पाणि आनंदकानी कर्या शिवाय शोडनुं पवन अंगीकार कुँ अने तेनी साथे तेने धरे गचा. दृष्टि पाणि तेनी आदरसंकार पूर्वक स्नान लोकनाडिथी धारणी मारी अक्षित करीने पोटाचेक दिवस पोताने मेर रेहेवानुं कह्युं अगर ले पोते के कामने साकृ त्यां आव्या इतो ते विरमृत थह्य गचा नहोतो तो पाणि शोडनुं पवन भान्य कर्या शिवाय उतापलथी कांधपिण्यु फार्थगिर्हि थाय तेम नथी अंडे ज्ञानीने तेजु त्यां रेहेवानुं कम्युन फुर्ह.

अहींया कुटलाचेक दिवस रह्या पढ़ी जेना आपत्ताची समस्त जनने थीभृत्यनो परिताप हर थेवा छे. गम्भीर्यपी ओचे सूर्योदयी लीको कंचुक पहेंदो छे अने अमरन जग्नाशें जग्नाशी लराई गधा छे अप्ती पांचकर्तुमां अंगीकार लक्ष्मीभर राजनो यहु छुटी जलपान करी आंदो आपतो इतो ते पापाने केम पूर्व जलाचरे अहाणु करवानी नवाहरती पाणीने तिये वापडाए गचा इतो तेम आ हुस्ती पाणि झाद्यमां इसाई गजा. नेम ते हुस्तीने ज्ञानवरयी शुक्त इरपाने अन्य हुस्तीचेक्ये अनेक अपत्तन कर्या छतां पाणि ते त्यांथी कूटी राक्षा नहोतो तेम आ हुस्तीने पाणि पेंकमांथी अहार लावता रान्यदेवकोच्चे अनेक युक्तिच्चा कर्या छतां पाणि घरहार नीक्षणाने समर्थ थेवा नही. छेवडे धरापतिये थाकीने, कांधपिण्यु माण्युस पोताना खुद्दिमण्यी अथवा इरकोए खीछ रीते ए हुस्तीने काद्यमांथी घरहार काढ तेने हुँ धर्मजीत धन आपाश, अवो ५४६

વજડાવ્યો. જેમ હરસીની ખુમ સાંભળી શ્રી કૃષ્ણને તેની સાગે ધાર્થ  
હતી તેમ રાખ્યાયકેનું એ મ્રમાણેનું વચન આપાણ કરી આરામ  
નંદન પણ તેમની પૂછે સત્ત્વર રાજની સમીપ આવ્યો અને ભૂપતિને  
યથાદ્ય્ય માણ્યા કરીને કહેવા લાગ્યો—

॥૫૩॥

### સત્ત્વ.

(અજા પુત્ર ગર્ભિત.)

શાંક્ષાળ પાને દર થી.

જે સમયે અભિપુત્રે અભિનિંદગાં ચંપાપાત કર્યો તે નમયે તે  
પુરુષો હાઇકાર કરવા લાગ્યા. “અરે લાઈ તે મહા સાહુન કર્મ  
કર્યું! અરે ઉપકારને અર્થે માણ દાન આપાયું!” એ મ્રમાણ ગહુગ્રદ  
કર્યે અને તીંગ સ્વરે રૂદ્ધ કરવા લાગ્યા. એવામાં પહેલપકાર કરવાના  
હુંએ કરીને જેનું વદનકુમળ અતિ મદ્દલિત છે અને પોતાના હરસીન  
મળને વિશે એ ઝળ ગૃહણું કરેલાં છે એવો કુંવર તે કુંભમાંથી તરત  
જ ખાદ્ય નિકળ્યો. તેના આપા સાઇસકુટ્યાઓ ને જોણાને અતિ હું  
આપ થયો એવા તે પુરુષો તે સમયે ‘નયનયકાર’ શાન્દનનું ઉચ્ચા.  
રણ કરતા હર્ષિની તાળીઓ પાડવા લાગ્યા. વળી કુંવરમટ્યે આશી  
ખેચન કરેવા લાગ્યા “હે કર્ણાસાગર તું ચિરમુશુ! પહેલપકાર  
કરવાને વિષે જેનું ચિત્ત નિરંતર ઉત્સુક છે એવો જે તું તેનો શરીર  
નય થાઓ!”

આપાં વચનો કહીનો તેણા કુંપરને પૂજા લાગ્યા “હે અન્ધુ!  
આપી જાયલયમાન અભિનમાંથી તું પ્રદિષ થયા કિનાય સહી સ  
લાભત રીતે નિકળ્યો?” તે વાઇ કુંવર એદ્યો કે આ અભિન  
પૃષ્ઠની દેવી આરી ઉપર તુષ્ટમાન થછ આ ઝળ મનો અર્પણ કરી  
સત્ત્વર અને રૂકી ગાઈ, માટે હુંએ આ ઝળ ગૃહણું કરી, તરે રૂ  
ચથાનકે ગમન કરો, અને તમારા માણુષી વાણી પુત્રની વિગતિ  
શી ગુકરા કરો.

સત્ર.

૫૫

અજાપુત્રના આપાં કથનો શ્રવણ કરીને તે પુરુષોએ કહું “હે મિત્ર ! તું સાહસિક હો, તે અમારા કૃત્યને માટે તારો દ્રષ્ટ આપાંગુ કરીને પ્રાતઃકાળે જેમ સૂર્યકમળની વિપત્તિનું હરણ કરેછે તેમ અમારી વિર્ધિત હરણ કર્બુ; માટે હે મહાભાગ ! અમાંનું એક ઇન્દ્ર તમે રાખો. અમારા પુત્રને એક ઇન્દ્રથી તેની સધારા વિપત્તિ હું થઈ આદેશયતા માસ થશો.” એ મમાંગુ અજાપુત્રને એક ઇન્દ્ર આપીને તે પુરુષોએ પેતાના પતન તરફ પ્રયાંગ કર્યું.

કુન્તર તે ઇન્દ્ર ગાંઠે પાંધી ચગાય રહેલું હે નગર તેના રસ્તા તરફ થાલ્યો. રસ્તે જતાં તેના અચલાગે જેમાં નવીન કુમળ મહુલ્લિત થાં છે, કંચુતર અકોર હંસ અને કાગ એવા વિવિધ જાતનાં અને વિવિધ રંગનાં વિહુંગો જેની આચાપાસ ગુંજારવ કરી રહ્યાં છે, જેની અંદરથી કુટલાએક મૂગપુષ્ટ નીમણેછે અને કુટલાએક ગવેશ કરેછે, જેનું જાળ નિર્માણ, રાહિદુને પીયાગાય છે, અને જેની ગંદર ગાયુંગે જગતના તરંગોથી આપતી આશર્યકારક હેઠાં નિતને સતોપ માસ કરાવેલે એવું વિશ્વીર્ણ જણેલર તેણું જૈયું. અત્યંત તૃપ્તા માસ થવાથી કુપર તે સદ્ગુરુમાંથી ધ્યેના જગતાત કરીને પોતાની તૃપ્તા શાંત કરી. પણ કલેકરને સંયુક્ત એવા પોતાના વાસુ જણેલરને કંડે મૂકીને અંગમદાલન કરવા નિમિત્તે તેણું પાદ્યામાં પ્રવેશ કર્યો. એવામાં કેળું જગતાના કંડને વિષે એક જીતાને હાર ધારણું કર્યો છે એવો એક વાનર તે રથણે આવ્યો. વચ્ચની અંદર રહેલ ઇન્દ્રના પરિમળથી દોલાઘણને તે વાનર વચ્ચની ગાંડ ઢેરડી ઇન્દ્ર ઉપાડી લઈ વનને વિષે નાશી ગયો. જયારે અજાનંદન જગતમાંથી ખાડાર આવ્યો અને કેવું તેણું જગતાનું વલ્લ દ્વારથ્યમાં લીધું તેવું તે ઇન નિતાનું દેખીને અત્યંત વિરગય ગાર્યો. મનને વિષે નિતને કરવા લાગ્યા કે આ વન અને જણેલાનને વિષે કારાગાય ગન્યાય જેવામાં આપતો નથી તો માર્દ ઇન્દ્ર કાળું આતી ગરું હોય. શુ કેદું

૮૦

## ઓન્નતંચે પ્રકાર.

દેવતાએ આદિય રહીને ગૃહાગુ કર્યુ હશો ! એમ વિચાર કરતો કરતે સરોવરની પાળ ઉપર ઘડી ચોતરફ દાઢી ફરવી આલેકુન કરે સે એટલામાં ત્યાં એક પુરુષ આજ્ઞાયો. તે પુરુષ તેને વંદન કરીને આમૃતમય વચને બ્યાલરા લાગ્યો “હે સ્વામિન ! મૂળ તો હું વાનર હતોં થોડા વખત પહેલાં આ જગ્યાએ આવી લોજનાંથે હું તમારા હણનું હરાગુ કરી ગયો. આહોથી હૂં જઈ જેવો તે કણનો રસ મેચાંયો કે તરતાજ હું પુરુષત્વપણું મળ્યે માસ થયો. હે ભદ્ર મુખ ! તમારું તે ઇણ જરાપણું ખંડિત કર્યા શિલાય મેં જેમનું તેમ રાજ્યું છે માટે તે આપ ગૃહાગુ કર્યા અને તે સાથે મારી ઉપર કૃપા કરીને આ દૈદિયમાન મુક્તમાળા આપને હું બેટ દાખલ આપુંધું તે પણ અંગીદાર કરો. હે મલો ! આપના મસાહે કરી હું આત્મયતમ નરભાપણાને પાર્યો તેથી જેમ છાંયા શરીરનીજ સાથે રહેછે તેમ હું સંદૂકાળ આપની સાથે રહીશ, અને આપના કિંદર તરીકે વર્તીશ.”

તેવારે ઇણના આપા મણાવથી સાંનદાશર્ય માસ થગાછે જેને એવો અનુપુત્ર ઇણ તથા હાર લઇને વિચારલા લાગ્યો કે આ અત્યુત્તમ ઇણનું મને આ મમાણે મથમ ઇણ માસ શયું કે જેનો જરામાત્ર રસ ચાખનાથી આ પુરુષનું તિર્યંચયાંયું હૂં થયું. મારું હોએ દૈદિયણ જગ્યાએ તે ઇણ લીધા શિલાય એકાકી ગમન કરું નહીં. દેશાદનને વિષે મને તે સંપૂર્ણ મહાયનૂત થણે મારાગુકે તે મહાગંત્રને દિવ્યરવરૂપી ઔષધી છે. એ મમાણે વિચાર કરીને જોતાના નુતન મિત્ર સહવર્ત્તમાન તેણે આગળ મયારા કરતું શક્ય કર્યું. ૨૨તે જરાં સૂર્ય અરત પાર્યો અને સંદ્યા પ્રગટ થયું. તેથલામાં તેણોએ એક યક્ષતું દેવળ જોયું. તે વખતે આકાશને વિષે ચંડોદય થવાથી જાણે રાનીરૂપી સી આકારારૂપી થાળમાં નસનરૂપ આકાર જરીને ગાઢાં ત્મા નરોને વધારવાં આવી લોય તેણી કોણાં દેખાતાં લાગ્યી. રસ્તાના પરિશ્રમથી ખજેજણું થકી ગયા હતા તેથી તે દેખામાં મવેરા કરીને તેણોએ ત્યાંજ વિશ્રામ કર્યો. આપુંધું,

## શ્રી જૈનર્ધમે પ્રકારાનો વંદરો.

શોઠ માળુકચંદ ભાગુણ વિજેરે ત્રાગુ અહુસ્થેને શ્રી સુરત જદ્ય ત્યાંનું સંઘ પાસે સર્વે હુકીકત નિવેદન કરવા માટે જરૂરું ડરાવ્યું.

પોતાની શુલ્ષ ધારાગુણ સુખાંગ તેઓ ધારેલા નગર મન્દિરના પહેંચયા. શ્રી સુખાંગના ચાંટરોડ રાષ્ટ્રેશન ઉપર આ ડેઝુટ્રેશનને ધારું હુર્ઝ સાથે દેવા માટે ત્યાંના શા. યોભાગુણ દમણ તથા શા. વીઠલદા મેતીચંદ વિજેરે સુમારે ૨૦-૨૫ અહુસ્થે પદ્ધારેલા હતા. અત્યં આનંદની સાથે તેઓની સુલાક્ષણ લાઈ તેઓની સાથે નગરમ મવેશ કર્યો.

પ્રથમ તો ત્યાંના શ્રાવકુણ વર્ગના મુશોડ પ્રેમચંદ રાય ચંદ, અવેરી પનાલાલ મુનમચંદ, શોઠ વીરચંદ દીપચંદ તથા શોઠલકચંદ માળુકચંદ વિજેરે 'સંભાળિત' અહુરસ્થેની સુલાક્ષણ લાંબા સર્વે હુકીકત રોચાન કરી. તે સાહેયોએ પણ પોતાની ભીતકંદ ધણીજ ખાતાની, અને તેથી મથુરજ સંતોષાંના ચિનહે રેખાવામાં આવ્યા. પછી તમામ શ્રાવક વર્ગના લક્ષ્યમાં તે હુકીકત ઉત્તારવાન જોધપણુથી તા. ઇ જીલ્લાધને દિવસે શ્રી જોડીજ મહારાજના દરાસરના પાછલા સાધારણ ખાતાના મકાનમાં એક જીટી સભા જૈન એસોશીઓશનના તરફથી ભરવામાં આવી. તે સમગ્ર સુમારું હુનર ઉપરાંત માળુકશાની ચારી ડડ જાગી હતી. પાલીતાગુણભાઈ કરખાનાના નોકરને માસ થંગેલા સંકટની જેણોએ ચોડી પણ પાત જગુલી અને તેથી કરીને જેમના મન અત્યંત દુઃખીત અનુભૂતા તે સંસ્કૃતી સધગી ખાખતો જાગુવાને અત્યુત્કંશિત હોયાથી તેઓના પદન સન્ગુન દૃષ્ટિ કરી રહા હતા. આ તેજાનું ખરું ધર્માભિમાન જાગુાઈ આપવું હતું.

રાત્રીના સુમારે સાડા આડ કલાકે રાગાનું કાગ શરૂ થયું

## શ્રી કૈતક્ષમી પ્રકાશનોવધારે.

૪

હતું. મારંભમાં સભાના મેંની મી. વિરચંદ રાધવળ એ. એ. એ શભા ભરવાનું કારણ જાણાવતાં હતું કે આજની સભામાં શ્રી ભાવનગ-રથી આવેલા ડેયુટેશન માંદેલા શ્રીજૈતેનધર્મ મસારક સભાના મેસી-ડેન્ટ શા. કુંપરણ વિ. આણંદલ શ્રી શત્રુંજ્ય તીર્થ સેણંધી ભાવણું કરેંદ્ર. ત્યાર ખાદ શેડ તલકુંદ માળેકુંદ દરખાસ્ત કરી અને તેને શા. કરમચંદ કલ્યાણાલુણે ટેકો આપ્યા કે શેડ ઓધવળ કરમચંદ મેસીડેન્ટની ખુરસીએ ખીરાજતું. એ દરખાસ્તથી તેઓ મનુષણસ્થાને બિરાજ્યા અને તેમની અતુજ્ઞા લઈને ભાવણું કર્તાએ મારંભમાં મેંગળીક રહોક કહીને ભાવણું શરૂ કર્યું.

આ ભાવણું ઘણું સ્પષ્ટ, અસરકારક, શાસ્ત્રોદ્ધત દ્રષ્ટાંતોથી યુક્ત અને જુસસા સાચે કરવામાં આવ્યું હતું એવું ઓતાઓના તરફથી પડતા વારંવાર હર્ષના પોકારથી જાગ્યાનું હતું. ભાવણું સુમારે દોઢ કલાક ચાહ્યા ખાદ સારી સભાસદોના નિર્દ્યાખાન મમાણું પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભાવણું કર્તાએ ભાવણમાં પાલીતાણાના આણંદલ કલ્યાણાલુણા કરખાનાની અગાઉની સ્થિતિ, હાલની સ્થિતિ, સં-મતકાળે સ્થિતિ ખગડવાનું કારણ, કરખાનાને થતી અડચણો, કરનારનાં નામ, તેનાં કારણો, અને અડચણો દૂર કરવા માટે ચોજવા જોઈએ તેવા ઉપય, સંઘની રુતિ અને મનુષ્ય જન્મ સાર્થક કરવા સંખેદના ગર્થ સાચે રવાકો એ મમાણું વિષયનો અ-તુકન રાખ્યો હતો. છેઠાં 'ધી કૈતક અભાશીભેદનથી' થતા કાયદા, તેના કાર્યોની મરંસા તથા હાલમાં શરૂ કરેલા કૈતક પંચાયત ઇડ સંખેદી સારી રીતે નિવેદન કર્યું હતું.

ભાવણું પુરું ધ્યા પડી ગી. તલકુંદ માળેકુંદ તે ભાવણની મરંસા સાચે ખીંચું કેટલુંએક ભાવણ કર્યું હતું અને છેઠાં 'ધી કૈતક અભાશીભેદનથી' એટચ (શાખા) દેક શહેરમાં રથાપત કરવાની

૪

## શ્રી નોવાર્દ્ધ પ્રકાશનો વધારો.

તેમજ તે સભામાં દરેક શ્રાવકભાઈને મેંમ્યાર તરીકે દાખલ થાયાની જરૂરીયાત જણાયી હતી. તો ઉપરથી પીળ કેટલાંઝેક ચુંગાઈવાથી બહુસ્થો સગાની અંદર મેંમ્યાર તરીકે દાખલ થયા હતા. ભાવનગરના ચુંગાઈ ગંધલામાંથી પાંચ તથા સુરતથી ડેયુટેશન સાથે આવેલા નાણું કુલ આડ બહુસ્થો મેંમ્યાર તરીકે દાખલ થયા હતા. અને ભાવનગરમાં પહેલા નંધરની એવા સ્થાપન કરવાની ભાવનગર નિપાસી બહુસ્થોએ કુલાત આપી હતી.

છેવટે જ્વેરી માણ્ણુકલાલ મેલાભાઈએ તરતની ખનાવેલી ‘માંગલીક્ય’ વચ્ચનો ગર્ભીત બે આર્થિ વાંચી સંભળાયા ખાદ સભા ખરખારત થઈ હતી.

ભાવનગરના અને સુરતના ડેયુટેશનની દરખારતથી તેમજ જોતાની ધારણાથી શ્રી ચુંગાઈના બહુરાણોએ શ્રી પૂને ગાર્નર માહેણી હઙ્ગુરમાં ડેયુટેશન તરીકે દ્વારા થયાને જોતાની ઉપર થતા પાલીતાણાના રાજ્યના જુદામના રાતીરિદર વણ્ણને ચુક્ત ઓક આરજ આપવાનો નિશ્ચય કર્યો. અને હુક્કા વણતમાં ઓક આરજ તૈયાર કરી.

કરેલા નિર્ણયને અતુસરીને તા. ૨૪ જુનાઈઝાડ શુદ્ધ ૨ ને લોમારાની ખંચોરની રૂતગાં શ્રી ચુંગાઈ, અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, કચ્છ, ભામનગર અને નાશક વિગેર શહેરોના તમામ ડેયુટેશનના ઓકવું થચ્છા (૩૫) બહુસ્થો શ્રી પૂને જલા નીકળા. ત્યાં જાણ્ય બહુસ્થોની સુલાક્ષાતનો લાલ લઈને તા. ૨૫ મી જુલાઈને દિવશે ગર્વની સાહેણાની સુલાક્ષાતનો વણત સુકર્ર ગા-ગવા માટે તેજો સાહેણાના સાર્વબેદ રેકોર્ડ્સ ગો. હાર્દ સાહેણાની ઉપર તમામ ડેયુટેશન માંદેલા બહુરાણના નાગેની આડ, આરજની ઓક નકુલ રાખ ચીડિનું ઓક પાડીનું કરીને જોકલવાગાં આવ્યું.

## શ્રી જૈનપર્મે પ્રડારાનો વધારો.

૫

જેનો મહુતુતર તેજો સાહેણા તરફથી તા. ૨૭ મીંદે આવ્યો અને તે ઉપરથી તા. ૨૮ મીની સવારના ઘરાયણ નવ કલાકે કાઉન્સીલ હોલમાં ગવર્નર સાહેબને મળાવાનું મુકૃરે હું.

મુકૃરે કરેલા દોષમે તમામ અહિસ્થો કાઉન્સીલ હોલમાં હાજર થયું હતા. ઘરાયણ નવ કલાકે માધ્યમે સહેઠો અને સવા નવ કલાકે ગવર્નર સાહેણ કૌંસીલ હોલમાં પદ્ધાર્યા. તે નામદાર સાહેખ તમામ અહિસ્થોને શેડુલેન્ડ કરીને મળા અને ડેચ્યુટેશને પાગુ ઘણ્ણા હું સાથે અને ઘણ્ણા સત્કાર યુક્ત તેમને વધાવ્યા.

મુલાકાતના મારંલમાં મી. મેમચેંડ રાઇચર્ડ કેટલુંઝેક ભાષાણ કર્યા એથ અરણ રજી કરી. તે અરણ ગવર્નર સાહેબે અગાજીથી વાંગેલી દેવાથી જે જે અહિસ્થોને કાંઈ અરજ કરવી દોય તે કરવા રજ આપી. જેથી શોઠ પનાલાલ પુનમચેંડ, શોઠ વીરચેંડ દીપચેંડ, શોઠ તલકચેંડ માલોકચેંડ, શા. મગનલાલ સરૂપચેંડ, ગાંધી નીરચેંડ રાધવળી, વોરા જવેર સુરચેંડ, તથા શા. કંપરણ આણંદું જે આતક કોમને માથે પડતા હુંણો લિન લિન રીતે જાહેર કર્યા. આ સધળી અરજના મહુતુતરમાં ગવર્નર સાહેબે ઘણ્ણો સંતોષકારક જવાય આપી તેજોને શાંત પમાઠયા. ચુમારે ગોણાદસ કલાકે કેટલાંજેક અહિસ્થો સાથે શેડુલેન્ડ કરી ગોતાની મીતિ તેમજ માયાળુણાનું દર્શાવી ડેચ્યુટેશનને રજ આપી. તેજ તારીખે તમામ ડેચ્યુટેશન મુંખ્યમાંબાનું અને તા. ૨૧ મીંદે શાપનગરના ડેચ્યુટેશને આપનગર તરફ આપવાનો વિચાર નક્કી કરી 'ઓંગાશીઓશન'ના અહિસ્થોની રજ મેળવી.

એક્સ્પ્રેસ વિચારી ડેચ્યુટેશન તેજ તારીખે રાતના ૮ કલાકે થાંટ્ઝેડ રદેશન ઉપર ભાપનગર તરફ જીલ્લેનમાં વિદ્યાય થા. નીકળાં. તે વખતે શોઠ કુફીરચેંડ મેમચેંડ, શા. ગોભાળું દામદાર, તથા શા. બાદચેંડ માલોકચેંડ નિર્ગેર ચુમારે પચાસ ચાહુરગો રદેશના

૬

## શ્રી જૈનપર્મુખ પ્રકાશનો વિષાણો.

ઉપર પદ્મારેલા હતા. તા. ૨૨ ગીતે ૨૨ઠે શ્રી શુરત ઉતાં અને  
ત્યાં મુનીરાજ શ્રી આત્મારાગભ મહારાજ વિગેર સમરત મુનીરંગળ-  
દર્શનનો લાલ લઈ તા. ૨૩ મીની સાંજના સાત કલાકે બાળનગર  
ના સ્ટેશને તે ડેઢુદેશન આવ્યું. કે વળતે મુમારે ૨૫ અહુરથી સામા  
આવ્યા હતા.

આ પ્રમાણે તે ડેઢુદેશન ધારેલું કાર્ય કરેલ કરી બાળનગરમાં  
અત્યેત આનંદ સાથે આવ્યું. છેવટે શાસનાદ્વિપતિ રેવની એટલીજ  
અને સુતિ કરીએ કે અમારા આપા શુરાતન વાળા બાઇઝોની  
મહેનત સર્જણ થાઓ અને સઘળ દુઃખનો અંત આવો.

તથાન્તુ.

—  —

१-३ शा. गोडमदास हरवंद.	१-३ शा. तलकुटी करमवंद.
१-३ शा. रतनवंद सुलवंद.	१-३ शा. दोआ उजमवंद.
१-० शा. देशपंड पदमशी	१-३ शा. मधुलिलाल अधाभाप.
१-० शोरा. उषमवंद भागुडवंद.	१-३ शा. नारसुल मुण्ड.
१-२ शा. नारसुल लाण्डाभाप.	१-३ शो. गोडमभाप इत्तेभाप.
१-३ शा. पालाभाप गीरधर.	१-३ शा. पालाभाप उजग्या.
१-३ गुरांडी गुरेवंद छपन.	१-० शा. परश्चातमदास हेमल.
१-० शा. मानवंद तारावंद.	१-३ शी. छुहारीना संधूत्पाते.
१-३ शा. कीरा. मध्यमवंद.	१-३ शा. नगिनदास अमवंद.
१-३ शा. वीठल राघवंद	१-३ शा. लाघमीर्जन वीतावर.

( खाली आवतामां )

१ गो. जयुलेशी घोगडीचो व्यामारी सलानी घोटीसमाथी रोकडी	कीभते भण्डे.	त्रिआ. पा.
२ सुभापित सतवनाभणी भाग १ लो.		०-३-०
२ सुभापित सतवनाभणी भाग २ लो.		०-४-०
३ सतवलेशी पूजा ( व्यात्सारामलु ढूळ )		०-३-०
४ वीशस्थानकानी पूजा ( " )		०-२-०
५ देवदृष्टि ( निष्ठंष )		०-२-०
६ समकितसद्योक्तार ( दुंडेभातुं अंडल )		०-४-०
७ प्रार्थनाभणी.		०-१-०
८ गोत्र प्रार्थनाभाणा अंडे पहुंचो.		०-१-०
९ सुर्योद सतवना वणी.		०-२-०
१० द्यानंद सरस्वती मुख्योटिका भाग १ लो.		०-४-०
११ गोत्र प्रार्थनाभाणा ( अंडे १ )		०-४-०

पोटेज गुड.

«कृत्तुमुक्ति»

MOGADISHU, 1960. — The following is a list of the  
titles of the books and pamphlets published by  
the Government of Somalia during the period  
July 1959 to June 1960.

卷之三

અને આપણી સેવા કરતું શકતાની જરૂર નથી. તો આપણી સેવાની જરૂર નથી. આપણી રાખી રહેવાની રાખી નથી. તો આપણી સેવાની જરૂર નથી. આપણી સેવાના મની અભિરૂદ્ધ પેગાઓએ વાયુ, તો દેવેશ શરૂઆતી વાયુને આપણે નથી.

iii

લવાજમ મોડલનારાઓને રાગવડુ.

१८५३) निम्न भाषुवेत गृहस्थोने वासवय असायी लागेन  
१८५४) अंगार्ये.

શ્રી ગુણપત્ર. શ્રી કૃતીસંગ્રહ પ્રેરણથી રજીસ્ટરેડ.

અન્યાંસી રાખાના ઓનાર્કો પ્રેરણિંદુ.

“ श्री भारतीय आर्थिक संगठन

श्री अमरदेवार्थ या. उत्तरायणी गुप्तकुमार श्री अ-

गर्वसे प्राप्ति भवतीति (१०.८) अपानि यह-

ਜਿ ਸ਼ਾਮੀ, ਸ਼ਾਮੀ, ਵਾਰਨੀ ਕਿਸਾਨ।

શ્રી મંત્રેશ. શ્રીમદ્ વિવિધ લખાણ.

২১৭২ কুল পরিমাণ। ২১৭৩ প্রক্ষেপণ করা হইল। ২১৭৪  
২১৭৩ ২১৭৫